

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ

બ્લોક નં.૨, પાંચમો માળ, કર્મચોગી ભવન, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર-૩૮૨૦૧૦

અગત્યની જાહેરાત

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ધ્વારા નીચે મુજબની જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૧૬-૧૭ નાયબ ચીટનીશ સંવર્ગમાં વધારાની ફાઇનલ સીલેકશન અને રેકમન્ડેશન યાદી તા ૧૦-૭-૨૦૧૭ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. ફાઇનલ સીલેક્ટ એન્ડ રેકમન્ડેશન લીસ્ટ પૈકી ઉમેદવારો હાજર ન થતાં/રાજીનામુ આપવાના કારણે ખાલી પડેલ જગ્યાઓ માટે પ્રથમ અગાઉ ફાઇનલ સીલેક્ટ એન્ડ રેકમન્ડેશન લીસ્ટ ધ્વારા જિલ્લા ફાઇનલ હોય અને જિલ્લામાં તે અન્વયે હાલમાં ફરજ બજાવતા હોય તેવા ઉમેદવારો/કર્મચારીઓને તેમની તે જ સીલેકશન કેટેગરી મુજબ મેરીટ પ્રમાણે મળવાપાત્ર જિલ્લાની ઓનસ્કિન પુનઃ ગોઠવણી (રીશફલીંગ) કરવાની રહે છે , અને ત્યારબાદ જિલ્લા પ્રમાણે બાકી રહેતી જગ્યાઓ ઉપર તા ૧૦-૦૭-૨૦૧૭ થી પ્રસિધ્ધ કરાવેલ એડીશનલ ફાઇનલ સીલેક્ટ લીસ્ટ મુજબના ઉમેદવારોને તેમની સીલેકશન કેટેગરી મુજબ ઓનસ્કિન જિલ્લા પસંદગીની તક આપવામાં આવશે, જે માટેનો કાર્યક્રમ નીચે મુજબ બોર્ડ ધ્વારા નક્કી કરવામાં આવેલ છે.

તારીખ	સમય	સંવર્ગનું નામ	વિગત
૨૫-૭-૨૦૧૭	બપોરે ૧૨-૦૦ કલાકે	જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૧૬-૧૭ નાયબ ચીટનીશ	રીશફલીંગ
૨૫-૭-૨૦૧૭	બપોરે ૧૨-૩૦ કલાકે	જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૧૬-૧૭ નાયબ ચીટનીશ	તા ૧૦-૦૭-૨૦૧૭ ની એડીશનલ સીલેકશન યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો

(નોંધ:- રીશફલીંગ = જે તે સંવર્ગમાં ૨૦૧૬-૧૭ ની ભરતીમાં અગાઉ ફાઇનલ સીલેક્ટ એન્ડ રેકમન્ડેશન લીસ્ટમાં સમાવેશ થયેલ અને અગાઉ જિલ્લા ફાઇનલ હોય અને હાલમાં તે અન્વયે જીલ્લામાં ફરજ બજાવતા હોય તેવા ઉમેદવારો)

બોર્ડ ધ્વારા અગાઉ પ્રસિધ્ધ કરવામાં આવેલ ફાઇનલ સીલેકશન એન્ડ રેકમન્ડેશન લીસ્ટ કમ ડીસ્ટ્રીક્ટ એલોકેશન લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને સંબંધિત સીલેકશન કેટેગરીમાં નિમણુંક પામેલ મેરીટોરીયર્સ ઉમેદવારોની જિલ્લાની પુનઃ ગોઠવણી (Reshuffling)ની કામગીરી પુરી થયા બાદ જ વધારાની આખરી પસંદગી યાદીમાં પસંદ થયેલા ઉમેદવારોને તેમની સીલેકશન કેટેગરી, મેરીટ અને તત્સમયે ઉપલબ્ધ જગ્યાના આધારે ઓનસ્કિન જિલ્લા ફાઇનલ કરવામાં આવશે.

આથી, જે તે સંવર્ગમાં ૨૦૧૬-૧૭ ની ભરતીમાં અગાઉ ફાઇનલ સીલેક્ટ એન્ડ રેકમન્ડેશન લીસ્ટ મુજબ જિલ્લા ફાઇનલ હોય અને હાલમાં તે અન્વયે તે જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા ઉમેદવારોને ઉપરોક્ત રીશફલીંગ કાર્યક્રમમાં સમયસર હાજર રહેવા આથી સુચના આપવામાં આવે છે.

તથા, તા ૧૦-૦૭-૨૦૧૭ ની એડીશનલ ફાઇનલ સીલેક્ટ એન્ડ રેકમન્ડેશન લીસ્ટમાં સમાવેશ થતા ઉમેદવારોને ઉપરોક્ત જિલ્લા ફાઇનલ કાર્યક્રમમાં સમયસર હાજર રહેવા આથી સુચના આપવામાં આવે છે.

વિશેષ સુચના:-

- (૧) ઉમેદવારોએ આપેલ સમયે સમયસર હાજર રહેવું, વિલંબથી આવનાર ઉમેદવારની રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિ. ઉમેદવારોએ પ્રથમ સમયસર હાજર થઇ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.
- (૨) ઉમેદવારે સ્વપર્ચે આવવાનું રહેશે. તેમજ પોતાના ઓળખના પુરાવા (અસલ તથા ઝેરોક્ષ નકલ) સાથે લાવવાના રહેશે.
- (૩) કોઇ કારણસર સંબંધિત ઉમેદવાર જાતે હાજર રહી શકે તેમ ન હોય તેવી પરિસ્થિતિમાં ઓથોરીટી લેટર સાથે અધિકૃત કરેલ વ્યક્તિને હાજર રાખી શકશે. સદર ઓથોરીટી લેટર ઉપર ઉમેદવારનો ફોટો અને જેને અધિકાર આપેલ છે તે વ્યક્તિનો ફોટો ચોટાડેલ હોવો જોઇએ અને સદર બંને ફોટા ઉપર સંબંધિત ઉમેદવારે સહી કરેલ હોવી જોઇએ.સદર અધિકૃત કરેલ વ્યક્તિ ધ્વારા કરવામાં આવેલ કાર્યવાહી સંબંધિત કર્મચારી/ઉમેદવારને બંધનકર્તા રહેશે. અધિકૃત કરેલ વ્યક્તિએ પોતાના ઓળખપત્રની અસલ અને ઝેરોક્ષ નકલ સાથે રાખવી.
- (૪) રીશફલીંગ કાર્યક્રમ માટેના ઉમેદવારે તેઓને આપવામાં આવેલ અસલ નિમણુંક હુકમ (ઝેરોક્ષ નકલ સાથે) લાવવાની રહેશે.
- (૫) રીશફલીંગ કાર્યક્રમ માટેના ઉમેદવારે તેઓ હાલ જે કચેરીમાં ફરજ બજાવે છે, તે કચેરીના વડાનું ઉમેદવાર હાલ નોકરીમાં ચાલુ હોવા અંગેનું પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે. પ્રમાણપત્રનો નમુનો સામેલ છે.
- (૬) રીશફલીંગ કાર્યક્રમમાં જે કોઇ પણ ઉમેદવાર હાજર રહેશે નહીં તો તેઓને અગાઉ ઓનસ્કિન ફાઇનલ કરવામાં આવેલ જિલ્લો માન્ય છે. તેમ માનીને આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તેવા ઉમેદવારોનો ભવિષ્યમાં પુનઃ જિલ્લા ગોઠવણી અંગેનો કોઇ હકક રહેશે નહિ.
- (૭) જો હાજર મેરીટોરીયર્સ ઉમેદવારને રીશફલીંગમાં તેને આપેલ જિલ્લા પસંદગી મળતી હશે પરંતુ જો સ્વેચ્છાએ ઉમેદવાર તે પસંદગી જતી કરશે તો ભવિષ્યમાં જે તે જિલ્લા ઉપર પણ પોતાનો હકક દાવો કરી શકશે નહિ.જેની નોંધ લેવી.
- (૮) અગાઉ સંબંધિત કેટેગરીમાં નિમણુંક પામેલ મેરીટોરીયર્સ ઉમેદવારોની પુનઃ ફાઇનલ (Reshuffling) ની કામગીરી પુરી થયા બાદ વધારાની આખરી પસંદગી યાદીમાં પસંદ થયેલા ઉમેદવારોને તેના મેરીટ, ઉપલબ્ધ જગ્યાના આધારે ઓનસ્કિન જિલ્લાની ફાઇનલ કરવામાં આવશે.
- (૯) સુચિત કાર્યક્રમમાં જરૂર જણાયે ફેરફાર કરવાનો, મુલતવી રાખવાનો/રદ કરવાનો અધિકાર બોર્ડને રહેશે.
- (૧૦) વિગતવાર વિગતો માટે પંચાયત વિભાગની વેબસાઇટ <https://panchayat.gujarat.gov.in> જોવા વિનંતી છે.
- (૧૧) હેલ્પલાઇન નં.૦૭૯-૨૩૨૫૮૫૩૪ (જે કચેરી કામકાજના દિવસો દરમ્યાન સવારે ૧૦-૩૦ થી ૬-૦૦ સુધી ચાલુ રહેશે.)
- (૧૨) રીશફલીંગ કાર્યક્રમ તથા જિલ્લા ફાઇનલ કાર્યક્રમનું સરનામું નીચે મુજબ છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, બ્લોક નં. ૨ , ડી વીંગ, પાંચમો માળ, કર્મચોગી ભવન, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર

સચિવ

તારીખ:-૧૧/૭/૨૦૧૭

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ

ગાંધીનગર